

સુરત મહાનગરપાલિકા
પ્રોફેશન ટેક્ષ રીકવરી સેલ

મુદ્દા નં. ૧ :- પોતાની સંસ્થા, કામગીરીઓ અને ફરજની વિગતો :-

The Particulars of its Organization, functions and duties :-

ગુજરાત રાજ્ય વ્યાપાર, ધંધા અને રોજગાર વેરા અધિનિયમ-૧૯૭૬ હેઠળ નાણાં વિભાગનાં જાહેરનામા ક્રમાંક નં.: (GHN-13) PFT-2008-S.12(1)(17)-TH :- તા.૦૧-૦૪-૨૦૦૮ થી વ્યવસાયવેરાની વસુલાત માટે મહાનગરપાલિકા હદ વિસ્તાર માટે મહાનગરપાલિકાને "ડેઝીનેટેડ ઓથોરીટી" જાહેર કરેલ છે. જે અનુસાર સુરત શહેર હદ વિસ્તારમાં વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર સાથે સંકળાયેલ (એનરોલમેન્ટ સર્ટિફિકેટ) તેમજ કામે રાખનાર એમ્પલોયર (રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ) વ્યક્તિ વર્ગોએ નોંધણી કરાવી વ્યવસાયવેરો સુરત મહાનગરપાલિકામાં ભરપાઈ કરવાનો રહે છે.

મુદ્દા નં. ૨ :- અધિકારીઓ / કર્મચારીના હોદ્દો અને ફરજો :-

The Powers and duties of its Officers and Employees:-

વ્યવસાયવેરા (સેન્ટ્રલ સેલ)

અ.નં.	હોદ્દો	કામગીરીની વિગત
૧	વ્યવસાયવેરા અધિકારી	૩.કમિશનરશ્રીની સૂચના મુજબ તમામ ઝોનનાં એ.આર.ઓ. અને વ્યવસાયવેરા અધિકારીઓ સાથે સંકલનમાં રહી વેરા વસુલાતની કામગીરી કરવી. વ્યવસાયવેરાની વસુલાત માટે જરૂરી આયોજન કરી યોગ્ય પગલા લેવા, વ્યવસાયવેરાના કરદાતાઓને વખતોવખત આપવા જોગ નોટીસ, ઈન્ટીમેશન લેટર વિગેરેનું આઈ.એસ.ડી.સાથે સંકલન કરી પ્રોગ્રામીંગ કરવાનું.
૨	સેક્રશન ઓફિસર	ખાતાની વહીવટી કામગીરી કરવી. મદદનીશ જાહેર માહિતી અધિકારી તરીકેની કામગીરી.
૩	આસી.એકાઉન્ટન્ટ	બજેટની કામગીરી, સેલ વિભાગના બીલના વાઉચરોની ચકાસણી કરવાની કામગીરી તથા વ્યવસાયવેરા વસુલાત સંબંધિત કામગીરી અને પ્રોફેશન ટેક્ષના ચેકો રીટન થાય તે ચેકોની ઝોનના સંકલનમાં રહી રીકન્સીલીએશનની કામગીરી.
૪	પ્રથમ શ્રેણી કલાર્ક	ઝોન લેવલ પરથી મોકલવામાં આવતી વ્યવસાયવેરાના પત્રકોની ચકાસણી કરી માહિતી એકનિત કરવી તેમજ સેક્રશન ઓફિસરની ગેરહાજરીમાં ઓફિસની વહીવટી કામગીરી સંભાળવી, વ્યવસાયવેરાની વસુલાત માટે ફીડમાં સ્થળ

		તપાસ કરવી.
૪	બીજી શ્રેણી કલાર્ક	યવસાયવેરાની ઈ.સી./આર.સી. કરદાતાઓનો રૂબરૂ સંપર્ક કરી વસુલાત અંગેની કામગીરી તથા અરજદારોની અરજીઓની ચકાસણી કરી નિકાલની કામગીરી.
૫	ત્રીજી શ્રેણી કલાર્ક	એસ્ટાબ્લિશમેન્ટને લગતી, ડીસ્પેચ, બીલ અંગેની કામગીરી, ઈ.સી./આર.સી. કરદાતાઓના નવા નોંધણી નંબર આપી વસુલાત કરાવવાની તથા ઓફિસની અન્ય પરચૂરણ કામગીરી.
૬	પટાવાળા	ખાતાની ટપાલ વિવિધ ડીપાર્ટમેન્ટમાં આપવી. સ્થાનિક ટપાલની વિતરણની કામગીરી. યવસાયવેરાના કરદાતાઓનો ફાઈલનો રેકર્ડ યવસ્થિત રાખવો.

**ITEM NO.: 3 THE PROCEDURE FOLLOWED IN THE DECISION MARKING PROCESS,
INCLUDING CHANNELS OF SUPERVISION ACCOUNTABILITY**

(1)

STAFF PATTERN

PROFESSION TAX RECOVERY CELL

DY. COMMISSIONER



PROFESSION TAX OFFICER



SECTION OFFICER

ASST.ACOUNTANT

(2)

ZONES



DY.COMMISSIONER



ASSISTANT COMMISSIONER



PROFESSION TAX OFFICER

(ASSESSMENT & RECOVERY OFFICER)



SECTION OFFICER

SHOPS & ESTT. INSPECTOR

મદ્દા નં.૪ :— પોતાના કાર્યો બજાવવા માટે નક્કી કરેલ ધોરણો :—

The norms set by it for the discharge of its functions :-

ગુજરાત રાજ્ય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર વેરા અધિનિયમ—૧૯૭૫ હેઠળ રાજ્ય સરકારશ્રીએ મહાનગરપાલિકા હદ વિસ્તાર માટે વ્યવસાય વેરાની નોંધણી, રીન્યુ અને ઉઘરાવવા માટે સુરત મહાનગરપાલિકાને " ડેઝીનેટેડ ઓથોરીટી " જાહેર કરેલ છે. જે અનુસાર સુરત શહેર હદ વિસ્તારમાં વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર સાથે સંકળાયેલ (એનરોલમેન્ટ સર્ટીફિકેટ) તેમજ કામે રાખનાર એમ્પલોયર—રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ વ્યક્તિ વગ્ાંએ નોંધણી કરાવી વ્યવસાયવેરો સુરત મહાનગરપાલિકામાં ભરપાઈ કરવાનો રહે છે.

➢ વ્યવસાયવેરો ભરપાઈ કરવાને જવાબદાર આર.સી.(રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ) કામે રાખનાર કરદાતાઓ માટે પ્રવર્તમાન દરોની માહિતી નીચે મુજબ છે.

અ.નં.	વ્યક્તિગતાનો વર્ગ	માસિક ભરવાનો વરો
૧	(ક) રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, પંચાયતો, રાજ્ય અને કેન્દ્ર સરકારના જાહેર ક્ષેત્રના ઉપકર્મા અને ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાઓ સિવાયની અન્ય સંસ્થાના પગારદારો અને વેતનદારો જેનો માસિક પગાર અથવા વેતન.—	
	(૧) રૂ. ૦/- થી રૂ.૨૫૫૫.૫૫ સુધી	શૂન્ય
	(૨) રૂ.૩૦૦૦/- થી રૂ.૫૫૫૫.૫૫ સુધી	શૂન્ય
	(૩) રૂ.૬૦૦૦/- થી રૂ.૮૫૫૫.૫૫ સુધી	શૂન્ય
	(૪) રૂ.૮૦૦૦/- થી રૂ.૧૨,૦૦૦.૦૦ સુધી	શૂન્ય
	(૫) રૂ.૧૨૦૦૦/- થી વધુ.	૨૦૦/-
	નોંધ:—(૧) ગુજરાત રાજ્ય સરકારશ્રીના નાણાં વિભાગના જાહેરનામા ક્રમાંક:(GHN-5)-PFT-2013-S.3(2)(7)-TH મુજબ તા.૦૧-૦૪-૨૦૧૩ થી રૂ.૩૦૦૦/- થી રૂ.૫૫૫૫.૫૫ સુધીનો આર.સી. વેરાનો દર શૂન્ય કરવામાં આવેલ છે. (૨) ગુજરાત રાજ્ય સરકારશ્રીના નાણાં વિભાગના જાહેરનામાં ક્રમાંક નં. GHN - 35-PFT - 2022 - S.3 (2)(10) -TH તા.૦૮-૦૪-૨૦૨૨ ના નોટીફિકેશન મુજબ રૂ.૧૨,૦૦૦/-સુધીનો	

	<p>આર.સી. વેરાનો માસિક દર શૂન્ય કરવામાં આવેલ છે.</p> <p>(ત) એક કર્મચારી પણ કામે રાખેલ હોય અને તેને રૂ. ૧૨૦૦૦/- થી વધુ માસિક પગાર ચૂકવવામાં આવતો હોય તેવા એમ્પલોયરે આર.સી.નંબર લેવો ફરજીયાત છે. આર.સી. વેરો દર માસની ૧૫મી તારીખ સુધીમાં ભરપાઈ કરવાનો રહે છે.</p>
	<p>વ્યવસાયવેરો ભરપાઈ કરવાને જવાબદાર નીચે જણાવેલ ઈ.સી. કરદાતાઓએ વાર્ષિક રૂ.૨,૦૦૦/- વેરો ભરપાઈ કરવાનો રહે છે.</p>
	<p>સોલીસીટરો અને નોટરી પબ્લિક સહિત કાયદા વ્યવસાયીઓ (એડવોકેટ)</p>
	<p>તથીબી સલાહકારો (કન્સલટન્ટો) અને દંત ચિકિત્સકો (ડેન્ટિસ્ટો) સહિત તથીબી વ્યવસાયીઓ</p>
	<p>આર્કિટેક્ટો, એન્જિનિયરો, આરસીસી કન્સલટન્ટો, ટેક્સ કન્સલટન્ટો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો, વીમાશાસ્ત્રીઓ અને મેનેજમેન્ટ કન્સલટન્ટો સહિત ટેકનીકલ અને પ્રોફેશનલ કન્સલટન્ટો.</p>
	<p>વીમા અધિનિયમ, ૧૯૭૮ (સને ૧૯૭૮ ના ૪થા) હેઠળ રજિસ્ટર થયેલા અથવા લાયસન્સ ધરાવતા ચીફ એજન્ટો, પ્રિન્સીપાલ એજન્ટો, સ્પેશિયલ એજન્ટો, ઈન્સ્યોરન્સ એજન્ટો અને સર્વેયરો અથવા લોસ એસેસરો.</p>
	<p>બિલીંગ કોન્ટ્રાક્ટરો સિવાયના તમામ કોન્ટ્રાક્ટરો, કમિશન એજન્ટો, દલાલો અને એસ્ટેટ બ્રોકરો સિવાયના બ્રોકરો.</p>
	<p>ઓટોમોબાઈલ બ્રોકર્સ, ટુર ઓપરેટર્સ અને ટ્રાવેલ એજન્ટ, કેબલ ટી.વી.ઓપરેટર્સ, ફિલ્મ વિતરકો.</p>
	<p>વિજ્ઞાપન એજન્સીઓના માલિકો, ટયુશન કલાસીસ અથવા ટયુટોરીયલ ઈન્સ્ટીટ્યુશન્સના માલિકો.</p>
	<p>કોમ્પ્યુટર શિક્ષણ તાલીમ અથવા કોમ્પ્યુટર નેટવર્ક મારફત ઓનલાઈન ઈન્ફોમેશન અને ડેટા બેઝ સર્વિસમાં રોકાયેલી સંસ્થાના માલિકો અથવા સેવા પૂરી પાડનારાઓ.</p>
	<p>ડ્રાઇવિંગ સ્કૂલના માલિકો, મેરેજ હોલ અને પાર્ટી પ્લોટના માલિકો, આંગારિયા અથવા કુરિયર સેવા પૂરી પાડનારા.</p>
	<p>હેલ્થ કલબ અને મનોરંજન કલબના માલિકો.</p>
	<p>વાયદા-સોદા (નિયમન) અધિનિયમ, ૧૯૮૨ (સન ૧૯૮૨ના ૭૪ મા) હેઠળ માન્ય થયેલા એસોસિયેશનના સભ્યો.</p>
	<p>સિક્યોરિટી સોદા (નિયમન) અધિનિયમ, ૧૯૮૬ ના ૪૨ માં હેઠળ માન્ય થયેલા સ્ટોક એક્સચેન્જના સભ્યો.</p>
	<p>ઓઈલ પમ્પો અને સર્વિસ સ્ટેશનોના માલિકો અને કોઈપણ ઓઈલ પંપો અને સર્વિસ સ્ટેશનો ભાડા પેટે આપ્યા હોય ત્યારે તેવા પેટે લેનારાઓ.</p>
	<p>મુંબઈ હુકાન અને સંસ્થા અધિનિયમ, ૧૯૪૮ (સન ૧૯૪૮ ના મુંબઈના ૭૮મા) માં વ્યાખ્યા કર્યા પ્રમાણે લાઈસન્સ ધરાવતા વિદેશી દારુ વેચનારા અને નિવાસી હોટલો અને થિયેટરોના માલિકો.</p>
	<p>કંપની અધિનિયમ, ૧૯૫૬ હેઠળ રજિસ્ટર થયેલી અને કોઈપણ વ્યવસાય, વ્યાપાર અથવા ધંધો કરતી પબ્લિક લિમિટેડ અથવા પ્રાઈવેટ લિમિટેડ કંપનીઓ.</p>
	<p>ચીટ ફંડોનું સંચાલન કરતી વ્યક્તિઓ અથવા સંસ્થાઓ.</p>

બેન્કિંગ નિયમન અધિનિયમ, ૧૯૪૮ (સન ૧૯૪૮ ના ૧૦મા) માં વ્યાખ્યા કર્યા પ્રમાણેની બેન્કિંગ કંપનીઓ.

ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ (૧૯૬૨ ના ગુજરાતના ૧૦મા) હેઠળ રજિસ્ટર થયેલી અથવા રજિસ્ટર થયેલી હોવાનું ગણાતી સહકારી સોસાયટીઓ.-

(ક) કોઈપણ વ્યવસાય, વ્યાપાર અથવા ધંધામાં રોકાયેલી રાજ્ય સ્તરની મંડળીઓ અને જિલ્લા સ્તરની મંડળીઓ.

(ખ) સરકારી સુગર ફેક્ટરીઓ અને સહકારી સ્થિપનીં મિલો.

એસ્ટેટ એજન્ટો અથવા એસ્ટેટ બ્રોકર્સ અથવા બિલ્ડીંગ કોન્ટ્રાક્ટરો.

વિડિયો પાર્લર્સ અથવા વિડિયો લાયબ્રેરી અથવા તે બન્નેના માલિકો અથવા બીજા કોઈપણ વિડિયો અથવા વિડિયો લાયબ્રેરી અથવા તે બન્ને ભાડા પેટે આપેલ હોય ત્યારે તેનેભાડા પેટે રાખનાર.

કોઈપણ વ્યવસાય, વ્યાપાર અથવા ધંધામાં રોકાયેલી ભારતીય ભાગીદારી અધિનિયમ, ૧૯૭૨ (સન ૧૯૭૨ ના ૮ મા) હેઠળ રજિસ્ટર થયેલી પેઢીઓ.

કારખાના અધિનિયમ, ૧૯૪૮ (સન ૧૯૪૮ ના ૬૩ મા) માં વ્યાખ્યા કર્યા પ્રમાણે કંપનીના ભોગવટેદારો.

મુંબઈ દુકાન અને સંસ્થા અધિનિયમ, ૧૯૪૮ (સન ૧૯૪૮ ના મુંબઈના ઉલ્લમા) માં વ્યાખ્યા કર્યા પ્રમાણે જે સંસ્થામાં વર્ષ દરમિયાન દિવસ દીઠ આશરે પાંચથી વધુ કર્મચારીઓ કામે રાખેલા હોય તેવી સંસ્થાના માલિકો.

મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ (સન ૧૯૮૮ ના પછ્યા) હેઠળ ભાડાથી અથવા બદલાની રકમ લઈને વપરાતા અથવા વાપરવા માટે અનુકૂળ બનાવેલા ટ્રાન્સપોર્ટ વાહનોના પરમીટ ધારકો જ્યારે આવી કોઈ વ્યક્તિ બે થી વધુ ટ્રાન્સપોર્ટ વાહનો, બસો, ટેક્સીઓ, ટ્રૂકો અથવા ત્રણ પેંડાવાળા મોટર વાહનોની પરમીટ ધરાવતી હોય ત્યારે.

મુંબઈ નાણાંની ધીરનાર કરનારાઓ બાબતના અધિનિયમ, ૧૯૪૬ (સન ૧૯૪૭ના ૩૧મા) હેઠળ લાયસન્સ આપેલા નાણાંની ધીરધાર કરનારાઓ.

* ગુજરાત મૂલ્યવર્ધિત વેરા અધિનિયમ, ૨૦૦૩ (સન ૨૦૦૫ના ૧૬ા) માં વ્યાખ્યાયિત કર્યા પ્રમાણેના વેપારીઓ, જેમના તમામ વેચાણો અથવા તમામ ખરીદીઓનું કુલ વાર્ષિક ટર્ન ઓવર પ્રમાણે નીચે મુજબ વાર્ષિક વ્યવસાયવેરો ભરપાઈ કરવાનો રહે છે.

(૧) રૂ.૨,૫૦,૦૦૦/- થી વધુ ન હોય તો	શૂન્ય
(૪) રૂ.૨,૫૦,૦૦૦/- થી વધુ હોય તો	રૂ.૨૫૦૦/-
નોંધ :- ગુજરાત સરકારશ્રીના ગેજેટ Extra No.13 Vol.2X11 Dt.09-04-2021 part.IV મુજબ ઈ.સી.વ્યવસાયવેરાના શીડ્યુલ-૧ ની નોંધ ક્રમાંક-૭ પછી નવી નોંધ-૭ એ મુજબ રૂ.૨૫૦૦૦૦/- થી વધુ ટર્નઓવર ન હોય તો વેરાનો દર શૂન્ય અને રૂ.૨૫૦૦૦૦/- થી વધુ ટર્નઓવર હોય તો વેરાનો દર રૂ.૨૫૦૦/- કરેલ છે.	

મદ્દા નં.૫ : કાર્યો કરવા માટેનાં નિયમો, વિનિયમો, સૂચનાઓ અને નિયમસંગ્રહ :-

The rules, regulations, Instructions, manuals and records held by it or under its control or used by its Employees for discharging its functions:-

વ्यवसायवेराना સંપूર્ણ શીડયુલની તેમજ ક્યા ક્યા વ्यવસાયીઓએ વ्यવસાયવેરો મહાનગરપાલિકામાં ભરવાનો થાય છે તેની સ્થાનિક ગુજરાતી વર્તમાનપત્રોમાં જાહેરાત સમયાંતરે પ્રસિદ્ધ કરવામાં આવે છે. વ्यવસાયવેરાના નિયમો – સમજૃતી માટે પેમ્ફલેટ છપાવી દરેક ઝોનમાં વહેંચણી કરવામાં આવે છે. કરદાતાઓની જાગૃતિ માટે રેડીયો એફ.એમ.પર જાહેરાત આપવામાં આવે છે. વ्यવસાયવેરાને લગતા સરકારશ્રીના કાયદા, જાહેરનામાઓ વિગેરે મહાનગરપાલિકાની વેબ સાઈટ પર મુક્કવામાં આવેલ છે.

મુદ્દા નં.૬ :– નિયંત્રણ હેઠળની વ્યક્તિત્વો પાસે ઉપલબ્ધ દસ્તાવેજો :–

A Statement of the categories of documents that are held by it or under its control :-

ગુજરાત રાજ્ય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર વેરા અધિનિયમ-૧૯૭૯ હેઠળના વ્યવસાયવેરા કાયદાના નિયમો, સરકારી જાહેરનામા (અધ્યતન), નોંધણીના ફોર્મ વિગેરે તથા પ્રોફેશન ટેક્ષ રીકવરી સેલના રેકર્ડ એસ.એમ.સી.ના રેકર્ડ રૂલ્સ-૧૯૬૫ મુજબ વર્ગીકૃત કરી નીચેની કેટેગરી વાઈજ નિભાવવામાં આવે છે.

રેકર્ડ કેટેગરી	રેકર્ડની વિગત	રેકર્ડનો સમય
B	→ એસ્ટાબ્લીસમેન્ટ પેપર્સની ફાઈલ	૨૦૧૧ થી
	→ કર્મચારીની સર્વિસ બુક	ખાતામાં ફરજ બજાવતા કર્મચારીઓની સર્વિસબુક
	→ પેન્શનર ફાઈલ	-- નીલ --
C	→ બીલ રજીસ્ટર	૨૦૦૮ થી
	→ બીલ પેમેન્ટ વાઉચર ફાઈલ	૨૦૦૮ થી
D	→ ઈન્ટેન્સ બુક	૨૦૧૧ થી
	→ સ્ટોક રજીસ્ટર	૨૦૧૧ થી
	→ આઉટવર્ડ, ઈન્વર્ડ રજીસ્ટર	૨૦૧૧ થી
	→ ગર્વમેન્ટ ગ્રાન્ટ મેળવવાની મંજુરી માટે પત્ર વ્યવહારની ફાઈલ	૨૦૧૧ થી

	→ નોંધ અંગેની ફાઈલ → ટેક્ષ રીફંડના પેપર્સની ફાઈલ → વાહન લોગબુક → અરજદારોની ટેક્ષ બાબતની અરજી અંગેની ફાઈલ	૨૦૧૧ થી
	→ ટપાલ બુક → કેળ્યુલ લીવ રીપોર્ટ → કર્મચારીનું હાજરીપત્રક	૨૦૧૪ થી
	→ જનરલ બોર્ડ અને સ્થાયી સમિતિ મીટિંગનો એજન્ડા	૨૦૧૪ થી
	→ બજેટ રીપોર્ટની ફાઈલ	૨૦૧૪ થી
E	→ ટપાલ બુક → કેળ્યુલ લીવ રીપોર્ટ → કર્મચારીનું હાજરીપત્રક	૨૦૧૪ થી
	→ જનરલ બોર્ડ અને સ્થાયી સમિતિ મીટિંગનો એજન્ડા	૨૦૧૪ થી
	→ બજેટ રીપોર્ટની ફાઈલ	૨૦૧૪ થી

મદ્દા નં.૭ :— નીતિનાં અમલ સંબંધી જનતાના સભ્યો સાથે સલાહ પરામર્શ બાબતની વ્યવસ્થા :—

The particulars of any arrangement that exists for consultation with or representation by, the members of the public in relation to the formulation of its policy or implementation thereof :-

લાગુ પડતું નથી.

મદ્દા નં.૮ :— વોર્ડ પરિષદ સમિતિનું પત્રક :—

The statement of the boards, councils, committees and other bodies, consisting of two or more persons constituting as its part or for the

purpose of its advice and as to whether meetings of those boards, councils, committees and other bodies are open to the public or the minutes of such meetings are accessible for public.

લાગુ પડતુ નથી.

મદ્દા નં.૮ :— પ્રોફેશન ટેક્સ રીકવરી સેલમાં ફરજ બજાવતાં કર્મચારીઓની વિગત :—

અ.નં.	અધિકારી/ કર્મચારીનું નામ	હોદ્દો	હાલનું રહેઠાણ (સંપૂર્ણ પોસ્ટલ એર્સે)
૧	શ્રી અર્જુનસિંહ બી. સોલંકી (૩૭૧૮૮)	ઈ.ચા.વ્યવસાયવેરા અધિકારી	૩૧-૪૦૪, ડિવાઈન ડિઝાયર, ન્યૂ એલ.પી.સવાણી સ્કુલ નજીક, પાલનપુર, કેનાલ રોડ, પાલનપુર, સુરત.
૨	" સંજીવ એમ.સોનાવાલા (૨૨૦૬૭)	સેક્શન ઓફિસર	૨૦, મહર્ષિ અરવિંદ સોસાયટી, ગંગેશ્વર મહાદેવની પાછળ, આદાજણ સુરત.
૩	" પી.એમ. ચૌધરી (૪૬૪૭૫)	આસી.એકાઉન્ટન્ટ	૧૨૪, અંબિકાપાઈ, રીજન્ટ પ્લાઝાની સામે, રામીપાઈની પાસે, ડીડોલી ઉધના, સુરત.
૪	" એચ.એસ.શાહ (૧૨૭૮૩)	કલાર્ક—૧	૩૬/૩૭ રણાથોડ નગર, પરવત પાટીયા દુંભાલ, ઓકટ્રોય નાકા પાછળ, સુરત.
૫	" પી.પી.પટેલ (૧૨૧૧૦)	કલાર્ક—૧	૩/૧૨૬૮, રામમંદિરની બાજુમાં, કોહીનુર માર્કેટની સામે, સલાભતપુરા, સુરત.
૬	શ્રીમતી લક્ષ્મીબેન કે.રાણા (૪૬૦૬૦)	ત્રીજી શ્રેણી કલાર્ક	૩/૩૮૨૦, કણાબી શેરી, નવાપુરા, સુરત
૭	" દેવ્યાનીબેન એ.પટેલ (૪૭૪૦૧)	—"—	૪૮૨, પીર ફળીયા, વેગામ, વાયા, ગડત, તા. ગણાદેવી, જી.નવસારી—૩૮૬૩૫૦
૮	શ્રી ઈંગ્રેડીમ કે. સાલેહભાઈ (૧૭૫૮૪)	પટાવણા	૭/૧૪૬, નગીના લેન, રાંદેર, સુરત-૫.
૯	" સંજયભાઈ અન. સેલર (૪૦૪૬૦)	પટાવણા	ઘર નં.૩, નારાયણ નગર સોસાયટી, હનુમાન ટેકરી પાસે, જહાંગીરપુરા રોડ, રાંદેર, સુરત.

મદ્દા નં.૧૦ :—તેના વિનિયમોમાં પૂરી પડાયેલી વળતરની પદ્ધતિ સહિત તેના દરેક
અધિકારીઓ અને કર્મચારીઓ ધ્વારા પ્રાપ્ત કરાયેલો માસિક પગાર :—

The monthly remuneration received by each of its Officers and Employees, including the system of compensation as provided in its regulations:-

સુરત મહાનગરપાલિકા જાહેર સત્તા મંડળ સાથે સંયુક્ત છે. અતેનાં ખાતાની અલાયદી
માહિતી નથી.

મદ્દા નં. ૧૧:- તમામ યોજનાઓની વિગતો, થયેલ ખર્ચ અને ફાળવાયેલ બજેટ :-

The Budget allocated to each of its agencies, indicating the particulars of all plans, proposed expenditure and reports on disbursements made :-

સરત મહાનગરપાલિકા જાહેર સત્તા મંડળ સાથે સંયુક્ત છે. અતેનાં ખાતાની અલાયદી માહિતી નથી.

મદ્દા નં. ૧૨ :- ફાળવાયેલ રકમ અને કાર્યક્રમોમાંથી ફાયદો (લાભાર્થી) મેળવનારની વિગતો સહિત સબસ્સીડી (આર્થિક સહાય) કાર્યક્રમોના અમલનો પ્રકાર :-

The manner of Execution of subsidy programmers, including the amount allocated and the details of beneficiaries of such programmers

:-

સરત મહાનગરપાલિકા જાહેર સત્તા મંડળ સાથે સંયુક્ત છે. અતેનાં ખાતાની અલાયદી માહિતી નથી.

મદ્દા નં. ૧૩:- તેના ધ્વારા અપાયેલી છૂટછાટો (રાહતો), પરવાનગીઓ અને સત્તા સૌંપણી મેળવનારની વિગતો :-

Particulars of recipients of concessions, permits or authorisations granted by it :-

સરત મહાનગરપાલિકા જાહેર સત્તા મંડળ સાથે સંયુક્ત છે. અતેનાં ખાતાની અલાયદી માહિતી નથી.

મદ્દા નં. ૧૪ :- ઈલેક્ટ્રોનિક સ્વરૂપે ઉપલબ્ધ માહિતી :-

Details in respect of the information, available to or held by it reduced in an Electronics form :-

લાગુ પડતુ નથી

મદ્દા નં. ૧૫ :- પુસ્તકાલય અથવા વાંચનખંડના કામનાં કલાકો સહિત માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો જો જાહેર ઉપયોગ માટે તેની જાળવણી કરાય હોય તો :-

The particulars of facilities available to citizens for obtaining information, including the working hours of a library or reading room, if maintained for public use :-

સરત મહાનગરપાલિકા જાહેર સત્તા મંડળ સાથે સંયુક્ત છે. અતેનાં ખાતાની અલાયદી માહિતી નથી.

મદ્દા નં. ૧૬ :- જાહેર માહિતી અધિકારીનું નામ અને હોદ્દો :-

The names, designation and other particulars of the public information officers.

શ્રી સંજીવ એમ. સોનાવાલા
સેક્શન ઓફિસર
પ્રોફેશન ટેક્ષ રીકવરી સેલ

મદ્દા નં. ૧૭:- દરાવી શકાય તેવી અન્ય કોઈ માહિતી અને ત્યારબાદ દર વર્ષે આ પ્રકાશનોને
અધ્યતન કરવી જોઈશો :-

Such other information as may be prescribed and thereafter update
these publications every year :-

સુરત મહાનગરપાલિકા જાહેર સત્તા મંડળ સાથે સંયુક્ત છે. અતેનાં ખાતાની અલાયદી
માહિતી નથી.

રજીસ્ટર નમૂનો:- ૧

- (૧) એપ્રિલ થી જુન-૨૦૨૩
- (૨) જુલાઈ થી સપ્ટેમ્બર-૨૦૨૩
- (૩) ઓક્ટોબર થી ડિસેમ્બર-૨૦૨૩
- (૪) જાન્યુઆરી થી માર્ચ-૨૦૨૪

સરત મહાનગરપાલિકા
અનેકાર-એ

(સામાન્ય વહીવટ વિભાગના તા. ૧/૫/૨૦૦૯ ના પરિપત્ર ક્રમાંક—
પીએડી/૧૦-૨૦૦૭-૩૩૫૩૬૪- આરટીઆઈસેલનું બિડાણ)

—: પ્રમાણપત્ર : —

આથી પ્રમાણિત કરવામાં આવે છે કે , મારી વડી કયેરી(પ્રોપર) તથા મારા વહીવટી કાર્યક્ષેત્રના આ સાથેની યાદી મુજબના જાહેર સત્તામંડળો ધ્વારા માહિતી અધિકાર અધિનિયમની કલમ-૪ અંતર્ગત સ્વંય જાહેર કરવાની બાબતો (પ્રોએક્ટીવ ડીસ્કલોઝર) (પી.એ.ડી.) તૈયાર કરવામાં આવી છે અને તા. ૦૧/૦૫/૨૦૨૪ ની સ્થિતિએ તે અધતન કરવામાં આવેલ છે. જેનું અમારા ધ્વારા માહે મે-૨૦૨૪ દરમ્યાન ઇન્સ્પેક્શન કમ ઓડીટ કરવામાં આવ્યું છે અને જે બાબતે ક્ષતિ અગર અપૂર્તી વિગતો જણાય હતી તેની પૂર્તતા કરાવવામાં આવી છે.

તા.૦૧/૦૫/૨૦૨૪ ની સ્થિતિએ હવે કોઈ જાહેર સત્તામંડળોના પ્રોએક્ટીવ ડીસ્કલોઝર (પી.એ.ડી.) નું ઇન્સ્પેક્શન-કમ- ઓડીટ બાકી રહેલ નથી.

તारीખ : -૦૫-૨૦૨૪
સુરત મહાનગરપાલિકા

ડ. કમિશનર
વિભાગીય વડા

કચેરીનુંનામ:-
પ્રોફેશનલ ટેક્સ રીકવરી
સેલ,
રૂમ નં. ૩૬, મુગલીસરા,
સુરત મહાનગરપાલિકા